

## મોક્ષ દ્વાર

(૬)

પ્રતિજ્ઞા (દોહરા)

બંધ્દ્વાર પૂરૌ ભયૌ, જો દુઃખ દોષ નિદાન।  
અબ બરનોં સંક્ષેપસોં, મોખ્દ્વાર સુખથાન ॥૧॥

શાન્દુરાચારના નાટકની વર્ણનાનું હું કરું છું, સંક્ષેપસોં = થોડામાં.

અર્થ :- દુઃખો અને દોષોના કારણભૂત બંધનો અધિકાર સમામ થયો હવે ટુંકામાં સુખના સ્થાનરૂપ મોક્ષ અધિકારનું વર્ણન કરું છું. ૧

મંગાલાચારણ (સવૈયા એકગ્રીસા)

ભેદગ્યાન આરાસોં દુફારા કરૈ ગ્યાની જીવ,  
આતમ કરમ ધારા ભિન્ન ભિન્ન ચરચૈ ।  
અનુભૌ અભ્યાસ લહૈ પરમ ધરમ ગહૈ,  
કરમ ભરમકૌ ખજાનો ખોલિ ખરચૈ ॥  
યૌહી મોખ મુખ ધાવૈ કેવળ નિકટ આવૈ,  
પૂરન સમાધિ લહૈ પરમકૌ પરચૈ ।  
ભયૌ નિરદૌર યાહિ કરનોં ન કણુ ઔર,  
એસો વિશ્વનાથ તાહિ બનારસી અરચૈ ॥૨॥

દ્વિધાકૃત્ય પ્રજ્ઞાક્રકચદલનાદ્વન્ધુપુરુષૌ  
નયન્પોદ્ધં સાક્ષાત્પુરુષમુપલભૈકનિયતમ् ।  
ઇદાનીમુન્મજ્ઞતસહજપરમાનન્દસરસં  
પરં પૂર્ણ જ્ઞાન કૃતસકલકૃત્યં વિજયતે ॥૧॥

**શાન્દાર્થ :**—અરચૈ=જાણો. ખરચૈ=દૂર કરે. પરચૈ=ઓળખે. નિરદૌર=સ્થિર. વિશ્વનાથ=સંસારનો સ્વામી. અરચૈ=વંદન કરે છે.

**અર્થ :**—જ્ઞાની જીવ જ્ઞાનવિજ્ઞાનની કરવતથી આત્મપરિણાતિ અને કર્મ પરિણાતિને ભિન્ન કરીને તેમને જુદી જુદી જાણો છે અને અનુભવનો અભ્યાસ તથા રત્નત્રયનું ગ્રહણ કરીને જ્ઞાનાવરણાદિ કર્મ અથવા રાગ-દ્રેષ આદિ વિભાવનો ખજાનો ખાલી કરી નાખે છે. આ રીતે તે મોક્ષની સંસુખ દોડે છે. જ્યારે કેવળજ્ઞાન તેની સમીપ આવે છે ત્યારે પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મા બની જાય છે અને સંસારનું ભટકવું મટી જાય છે તથા કરવાનું કાંઈ બાકી રહી જતું નથી અર્થાત્ કૃતકૃત્ય થઈ જાય છે. આવા ત્રિલોકીનાથને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૨.

સમ્યગ્જ્ઞાનથી આત્માની સ્થિરતા થાય છે. (સવैયા એકગ્રીસા)

કાહૂ એક જૈની સાવધાન હૈ પરમ પૈની,  
 એસી બુદ્ધિ છૈની ઘટમાંહિ ડાર દીની હૈ।  
 પૈઠી નો કરમ ખેડી દરવ કરમ છેદિ,  
 સુભાઉ વિભાઉતાકી સંધિ સોધિ લીની હૈ॥  
 તહાં મધ્યપાતી હોય લખી તિન ધારા દોય,  
 એક મુધામર્ડ એક સુધારસ-ભીની હૈ।  
 મુધાસોં વિરચિ સુધાસિંધુમૈં મગન ભર્ડ,  
 એતી સબ ક્રિયા એક સમૈ બીચી કીની હૈ॥૩॥

**શાન્દાર્થ :**—સાવધાન=પ્રમાદ રહિત. પૈની=તીક્ષ્ણ. પૈઠી=ધૂસી. સંધિ=મિલનસ્થાન. મધ્યપાતી=વચ્ચે પડીને. મુધામર્ડ=અજ્ઞાનમય. સુધારસ=અમૃતરસ. વિરચિ=છોડીને.

**અર્થ :**—જૈન શાસ્ત્રના શાતા એક જૈને ઘણા સાવધાન થઈને વિવેકરૂપી તીક્ષ્ણ

પ્રજ્ઞાછેત્રી શિલેયં કથમપિ નિપુણૈ: પાતિતા સાવધાનૈ:

સૂક્ષેઽન્તઃસંધ્યબન્ધે નિપતતિ રખસાદાત્મકર્મોભયસ્ય ।

આત્માનં મગ્નમંતઃસ્થિરવિશદલસદ્ગ્રામિનિ ચैતન્યપૂરે

બન્ધં ચાજ્ઞાનભાવે નિયમિતમભિતઃ કુર્વતી ભિન્નભિન્નૌ ॥૨॥

છીણી પોતાના હદ્યમાં નાખી દીધી, જેણે પ્રવેશ કરતાં જ નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નિજસ્વભાવનું જુદાપણું કરી નાખ્યું. ત્યાં તે જ્ઞાતાએ વચ્ચે પડીને એક અજ્ઞાનમય ને એક જ્ઞાનસુધારસમય એવી બે ધારા દેખી. ત્યારે તે અજ્ઞાનધારા છોડીને જ્ઞાનરૂપ અમૃતસાગરમાં ભર્ણ થયો. આટલી બધી કિયા તેણે માત્ર એક સમયમાં જ કરી. ૩.

વળી—

(દોહરા)

જૈસે છેની લોહકી, કરૈ એકસૌં દોઇ।  
જડ ચેતનકી ભિન્નતા, ત્યાં સુબુદ્ધિસૌં હોઇ॥૪॥

**અર્થ :**—જેવી રીતે લોઢાની છીણી કાષ્ટ આદિ વસ્તુના બે ટુકડા કરી નાખે છે તેવી જ રીતે ચેતન-અચેતનનું પૃથક્કરણ ભેદવિજ્ઞાનથી થાય છે. ૪

સુબુદ્ધિનો વિલાસ  
(સર્વ વર્ણ લઘુ, ચિત્રકાવ્ય ધનાક્ષરી)

ધરતિ ધરમ ફલ હરતિ કરમ મલ,  
મન વચ તન બલ કરતિ સમરપન।  
ભખતિ અશન સિત ચખતિ રસન રિત,  
લખતિ અમિત વિત કરિ ચિત દરપન॥  
કહતિ મરમ ધુર દહતિ ભરમ પુર,  
ગહતિ પરમ ગુર ઉર ઉપસરપન।  
રહતિ જગતિ હિત લહતિ ભગતિ રતિ,  
ચહતિ અગતિ ગતિ યહ મતિ પરપન॥૫॥

**શાલાર્થ :**—ભખતિ=ખાય છે. અશન=ભોજન. સિત=ઉજ્જવળ. અમિત=અપ્રમાણ.  
દહિત=બાળે છે. પુર=નગર. ઉપસરન=સ્થિર. અગતિ ગતિ=મોક્ષ

**અર્થ :**—સુબુદ્ધિ ધર્મરૂપ ફળ ધારણ કરે છે, કર્મમળ હરે છે, મન, વચન, કાય ત્રણે બળોને મોક્ષમાર્ગમાં લગાવે છે, જીભથી સ્વાદ લીધા વિના ઉજ્જવળ જ્ઞાનનું

ભોજન ખાય છે, પોતાની અનંત જ્ઞાનરૂપ સંપત્તિ ચિત્તરૂપ દર્પણમાં દેખે છે, મર્મની વાત અર્થાતું આત્માનું સ્વરૂપ બતાવે છે, મિથ્યાત્વરૂપ નગર ભસ્મ કરે છે, સદ્ગુરુની વાણીનું ગ્રહણ કરે છે, ચિત્તમાં સ્થિરતા લાવે છે, જગતની હિતકારી બનીને રહે છે, ત્રિલોકીનાથની ભક્તિમાં અનુરાગ કરે છે, મુક્તિની અભિવાષા ઉત્પત્ત કરે છે, એવો સુખુદ્ધિનો વિલાસ છે.

સમ્યગ્જ્ઞાનીનું મહત્વ.  
(સર્વ વર્ણ ગુરુ. સવૈયા એકત્રીસા)

રાણાકૌસૌ બાના લીનૈ આપ સાધૈ થાના ચીનૈ,  
દાનાઅંગી નાનારંગી ખાના જંગી જોધા હૈ।  
માયાબેલી જેતી તેતી રેતૈમૈં ધારેતી સેતી,  
ફંદાહીકૌ કંદા ખૌદૈ ખેતીકૌસૌ લોધા હૈ॥  
બાધાસેતી હાંતા લોરૈ રાધાસેતી તાંતા જોરૈ,  
બાંદીસેતી નાતા તોરૈ ચાંદીકૌસી સોધા હૈ।  
જાનૈ જાહી તાહી નીકૈ માનૈ રાહી પાહી પીકૈ,  
ઠાનૈ બાતૈં ડાહી એસો ધારાબાહી બોધા હૈ॥૬॥

**શાલાર્થ :**—રાણા=બાદશાહ. બાના=વેશ. થાના=સ્થાન. ચીનૈ=ઓળખે. દાનાઅંગી=પ્રતાપી. ખાના જંગી જોધા=યુદ્ધમાં મહા શૂરવીર. કંદા=કાંસના મૂળિયા. ખેતીકૌસૌ લોધા=ખેડૂત જેવો. બાધા=કલેશ. હાંતા લોરૈ=અલગ કરે છે. તાંતા=દૌર. બાંદી=દાસી, નાતા=સંબંધ. ડાહી=હોશિયારી. બોધા=જ્ઞાની.

**અર્થ :**—ભેદવિજ્ઞાની જ્ઞાતાએ રાજા જેવું રૂપ બનાવેલું છે, તે પોતાના આત્મરૂપ સ્વદેશની રક્ષા માટે પરિણામોની સંભાળ રાખે છે અને આત્મસત્તા ભૂમિરૂપ સ્થાનને ઓળખે છે, પ્રથમ સંવેગ, અનુકુંપા આદિની સેના સંભાળવામાં દાના અર્થાતું પ્રવીણ હોય છે, શામ, દામ, દંડ, ભેદ આદિ કળાઓમાં કુશળ રાજાની સમાન છે, તપ, સમિતિ, ગુમિ, પરિષહજ્ય, ધર્મ, અનુપ્રેક્ષા આદિ અનેક રંગ ધારણા

કરે છે, કર્મરૂપી શત્રુઓને જીતવામાં ઘણો બહાદુર છે, માયારૂપી જેટલું લોકું છે તે બધાનો નાશ કરવામાટે રેતી સમાન છે, કર્મના ફંડારૂપ કાંસને ભૂળમાંથી ઉખેડવા માટે કિસાન સમાન છે, કર્મબંધના દુઃખોથી બચાવનાર છે, સુમતિ રાધિકા સાથે પ્રીતિ જોડે છે, કુમતિરૂપ દાસી સાથે સંબંધ તોડે છે. આત્મપદાર્થરૂપ ચાંદીનું ગ્રહણ કરવામાં અને પરપદાર્થરૂપ ધૂળને છોડવામાં સોની સમાન છે. પદાર્થને જેવો જાણો છે તેવો જ માને છે, ભાવ એ છે કે હેયને હેય જાણો છે અને હેય માને છે. ઉપાદેય જાણો છે એ ઉપાદેય માને છે,<sup>૧</sup> એવી ઉત્તમ વાતોના આરાધક ધારા પ્રવાહી જ્ઞાતા છે. ૬

જ્ઞાની જીવ જ ચક્કવર્તી છે.

(સવૈયા એકત્રીસા)

જિન્હકૈ દરબ મિતિ સાધન છખંડ થિતિ,  
બિનસૈ વિભાવ અરિ પંકતિ પતન હૈને।  
જિન્હકૈ ભગતિકો વિધાન એઈ નૌ નિધાન,  
ત્રિગુનકે ભેદ માનૌ ચૌદહ રતન હૈને॥  
જિન્હકૈ સુબુદ્ધિરાની ચુરે મહા મોહ વજ્ર,  
પૂરૈ મંગલીક જે જે મોખકે જતન હૈને।  
જિન્હકે પ્રમાન અંગ સૌહૈ ચમૂ ચતુરંગ,  
તેઈ ચક્રવર્તી તનુ ધરૈ પૈ અતન હૈને॥૭॥

**શાલાર્થ :**—અરિ પંક્તિ=શત્રુઓનો સમૂહ. પતન=નષ્ટ થવું. નવ નિધાન=નવ નિધિ. મંગલીક=મંડળ, ચોક. ચમૂ=સેના. ચતુરંગ=સેનાના ચાર અંગ—હાથી, ઘોડા, રથ, પાયદળ. અતન=શરીરરહિત

**અર્થ :**—જ્ઞાની જીવ ચક્કવર્તી સમાન છે કારણ કે ચક્કવર્તી છ ખંડ પૃથ્વી જીતે છે, જ્ઞાની છ દ્રવ્યોને સાધે છે, ચક્કવર્તી શત્રુઓનો નાશ કરે છે, જ્ઞાની જીવ વિભાવ

૧. આત્મા અડના માવા (અંદરનો ભાગ) મગજ આદિ સમાન ઉપાદેય છે અને ફોતરા વગેરે સમાન શરીરાદિ હેય છે.

પરિણાતિનો વિનાશ કરે છે, ચક્રવર્તીને નવનિધિ<sup>૧</sup> હોય છે, જ્ઞાની નવભક્તિ<sup>૨</sup> ધારણ કરે છે, ચક્રવર્તીને ચૌદ રત્ન<sup>૩</sup> હોય છે, જ્ઞાનીઓને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદરૂપ ચૌદરત્ન<sup>૪</sup> હોય છે, ચક્રવર્તીની પટરાણી દિગ્નિજ્ય માટે જવાને સમયે ચપટીથી વજરતનનો ભૂકો કરીને ચોક પૂરે છે, જ્ઞાની જીવોની સુખુદ્ધરૂપ પટરાણી મોક્ષમાં જવાના શુકન કરવા માટે મહામોહરૂપ વજનું ચૂઝ્યો કરે છે, ચક્રવર્તીને હાથી, ઘોડા, રથ, પાયદળ અદ્વિતીય ચતુરંગિણી સેના હોય છે, જ્ઞાની જીવોને પ્રત્યક્ષ, પરોક્ષ, નય, પ્રમાણ અને નિક્ષેપ હોય છે. વિશેષ એ છે કે ચક્રવર્તીને શરીર હોય છે પણ જ્ઞાની જીવ દેહથી વિરક્ત હોવાના કારણે શરીરરહિત હોય છે તેથી જ્ઞાની જીવોનું પરાક્રમ ચક્રવર્તી સમાન છે. ૭

નવ ભક્તિના નામ  
(દોહરા)

**શ્રવન કીરતન ચિંતવન, સેવન બંદન ધ્યાન।  
લઘુતા સમતા એકતા, નૌધા ભક્તિ પ્રવાન ॥૮॥**

શાલ્લાય :—શ્રવન=ઉપાદેય ગુણોનું સાંભળવું. કીરતન(કીરતન)=ગુણોનું વ્યાખ્યાન કરવું.  
ચિંતવન=ગુણોનો વિચાર કરવો. સેવન=ગુણોનું અધ્યયન કરવું. બંદન=ગુણોની સુતિ કરવી.

૧. મહાકાલ અસિ મસિકે સાધન, દેત કાલનિધિ ગ્રંથ મહાન,  
માનવ આયુધ ભાંડ નસરપ, સુભગ પિંગલા ભૂષન ખાન.  
પાંડુક નિધિ સબ ધાન્ય દેત હૈ, કરૈ શંખ વાજિંત્ર પ્રદાન,  
સર્વ રતન રત્નોકી દાતા, વશ દેત નિધિ પચ મહાન.
૨. નવ ભક્તિના નામ આગળ દોહામાં છે.
૩. ચક્રવર્તીના ચૌદ રત્નોમાં સાત સજીવ રત્ન હોય છે અને સાત અજીવ હોય છે. તે આ પ્રકારે છે :—  
(દોહરા) સેનાપતિ ગ્રહપતિ થપાતિ, પ્રોહિત નાગ તુરંગ,  
બનિતા મિલિ સાતોં રતન, હેં સજીવ સરવંત. ૧.  
ચક છત્ર અસિ દંડ મણિ, ચર્મ કંકણી નામ,  
યે અજીવ સાતોં રતન, ચક્રવર્તી કે ધામ. ૨
૪. કવિએ ચૌદ રત્નોની સંઘ્યા ત્રણ ગુણભેદોમાં ગણાવેલ છે. તે સમ્યગ્દર્શનના ઉપશમ, ક્ષયોપશમ,  
ક્ષયિકાએ ત્રણ, જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ એ પાંચ, અને ચારિત્રનાં  
સામાયિક, છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને સંયમાસંયમ એ છ—આવી રીતે  
બધા મળીને ચૌદ જણાય છે.

ધ્યાન=ગુણોનું સ્મરણ કરવું. લઘુતા=ગુણોનો ગર્વ ન કરવો. સમતા=બધા ઉપર એકસરખી દટ્ઠિ રાખવી. એકતા=એક આત્માને જ પોતાનો માનવો, શરીરાદિને પર માનવા.

**અર્થ :-**—શ્રવણ, કીર્તન, ચિંતવન, સેવન, વંદન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા—આ નવ પ્રકારની ભક્તિ છે, જે જ્ઞાની જીવ કરે છે. ૮.

જ્ઞાની જીવનું મંતવ્ય  
(સવૈયા એકબ્રીસા)

કાऊ અનુભવી જીવ કહૈ મેરે અનુભૌમે,  
લક્ષન વિભેદ ભિન્ન કરમકૌ જાલ હૈ।  
જાનૈ આપા આપુકૌં જુ આપુકરિ આપુવિષે,  
ઉત્પત્તિ નાસ ધ્રુવ ધારા અસરાલ હૈ॥  
સારે વિકલપ મોસોં ન્યારે સરવથા મેરો,  
નિહચૈ સુભાવ યહ વિવહાર ચાલ હૈ।  
મૈં તૌ સુદ્ધ ચેતન અનંત ચિનમુદ્રાધારી,  
પ્રભુતા હમારી એકરૂપ તિહું કાલ હૈ॥૧॥

**અર્થ :-**—આત્માનુભવી જીવ કહે છે કે અમારા અનુભવમાં આત્મસ્વભાવથી વિરુદ્ધ ચિહ્નોની ધારક કર્માંની જળ અમારાથી ભિન્ન છે તેઓ પોતે<sup>૧</sup> પોતાને<sup>૨</sup> પોતા દ્વારા<sup>૩</sup> પોતાનામાં<sup>૪</sup> જાણે છે. દ્રવ્યની ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રિગુણ ધારા જે મારામાં વહે છે, તે વિકલ્પો વ્યવહારનયથી છે, મારાથી સર્વથા ભિન્ન છે, હું તો નિશ્ચયનયના વિષયભૂત શુદ્ધ અને અનંત ચૈતન્યમૂર્તિનો ધારક છું, મારું આ સામર્થ્ય સદા એકસરખું રહે છે—કદી ઘટતું—વધતું નથી. ૮.

૧. આ કર્તારૂપ છે. ૨. આ કર્મરૂપ છે. ૩. આ કરણરૂપ છે. ૪. આ અધિકારણ છે.

ભિત્તા સર્વમણિ સ્વલક્ષણબલાદ્રેતું હિ યચ્છવ્યતે  
ચિન્મુદ્રાદ્વિતનિર્વિભાગમહિમા શુદ્ધશ્વિદેવાસ્મ્યહમ્ ।  
ભિદ્યન્તે યદિ કારકાણ યદિ વા ધર્મા ગુણ વા યદિ  
ભિદ્યન્તાં ન ભિદાસ્તિ કાવન વિભૌ ભાવે વિશુદ્ધે ચિત્ત ॥૩॥

આત્માના ચેતન લક્ષણનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા)

નિરાકાર ચેતના કહાવૈ દરસન ગુન,  
સાકાર ચેતના સુદ્ધ જ્ઞાન ગુનસાર હૈ।  
ચેતના અદ્વૈત દોષ ચેતન દરબ માંહિ,  
સામાન વિશેષ સત્તાહીકૌ વિસતાર હૈ॥  
કોઝ કહૈ ચેતના ચિહ્ન નાંહી આત્મામૈ,  
ચેતનાકે નાસ હોત ત્રિવિધ વિકાર હૈ।  
લક્ષનકૌ નાસ સત્તા નાસ મૂલ વસ્તુ નાસ,  
તાતૈ જીવ દરબકૌ ચેતના આધાર હૈ॥૧૦॥

**શાસ્ત્રાર્થ :**—નિરાકાર ચેતના=જીવનો દર્શનગુણ જે આકાર આદિને જાણતો નથી. સાકાર ચેતના=જીવનો જ્ઞાનગુણ જે આકાર આદિ સહિત જાણો છે. અદ્વૈત=એક. સામાન્ય=જેમાં આકાર આદિનો વિકલ્પ હોતો નથી. વિશેષ=જે આકાર આદિ સહિત જાણો છે. ચિહ્ન(ચિહ્ન)=લક્ષણ. ત્રિવિધ=ત્રણ પ્રકારના. વિકાર=દોષ.

**અર્થ :**—ચૈતન્યપદાર્થ એકરૂપ જ છે, પણ દર્શનગુણને નિરાકાર<sup>૧</sup> ચેતના અને જ્ઞાનગુણને સાકાર<sup>૨</sup> ચેતના કહે છે. ત્યાં આ સામાન્ય અને વિશેષ બન્ને એક ચૈતન્યના જ ભેદો છે, એક જ દ્રવ્યમાં રહે છે. વૈશેષિક આદિ મતવાદીઓ આત્મામાં ચૈતન્યગુણ માનતા નથી, તેથી તેમને જૈન મતવાદીઓનું કહેવું છે કે ચેતનાનો અભાવ માનવાથી

૧-૨ પદાર્થને જાણવા પહેલાં પદાર્થના અસ્તિત્વનું જે કિંચિત્તુ ભાન થાય છે તે દર્શન છે, દર્શન એ નથી જાણતું કે પદાર્થ કેવા આકાર કે રંગનો છે, તે તો સામાન્ય અસ્તિત્વ માત્ર જાણો છે તેથી જ દર્શનગુણ નિરાકાર અને સામાન્ય છે. એમાં મહાસત્તા અર્થાત્ સામાન્ય સત્તાનો પ્રતિભાસ થાય છે. આકાર, રંગ આદિનું જાણવું તે જ્ઞાન છે, તેથી જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે, વિશેષ જાણો છે. એમાં અવાંતર સત્તા અર્થાત્ વિશેષ સત્તાનો પ્રતિભાસ થાય છે. (વિશેષ સમજવા માટે ‘બૃહદ્ દ્રવ્યસંગ્રહ’ની જે સામણણં ગાહણું’ આદિ ગાથાઓનું અધ્યયન કરવું જોઈએ.

અદ્વૈતાપિ હિ ચેતના જગતિ ચેદ્ દૃગ્જાપ્રિસ્તિં ત્વજેત્  
તત્સામાન્યવિશેષરૂપવિરહાત્સાઽસ્તિત્વમેવ ત્વજેત્ ।  
તત્યાગે જડતા ચિતોપિ ભવતિ વ્યાપ્યો વિના વ્યાપકા-  
દાત્મા ચાન્તમુપૈતિ તેન નિયતં દૃગ્જાપ્રિસ્તિપાસ્તુ ચિત્ ॥૪॥

ત્રણ દોષ ઉત્પત્તિ થાય છે. પ્રથમ તો લક્ષણનો નાશ થાય છે. બીજું લક્ષણનો નાશ થવાથી સત્તાનો નાશ થાય છે. ત્રીજું સત્તાનો નાશ થવાથી મૂળ વસ્તુનો જ નાશ થાય છે. તેથી જીવદ્રવ્યનું સ્વરૂપ જાણવા માટે ચૈતન્યનું જ અવલંબન છે. ૧૦.

(દોહરા)

ચેતન લક્ષન આત્મા, આત્મ સત્તા માંહિ।  
સત્તાપરિમિત વસ્તુ હૈ, ભેદ તિહુમેં નાંહિ॥૧૧॥

અર્થ :—આત્માનું લક્ષણ ચેતના છે અને આત્મા સત્તામાં છે, કારણ કે સત્તા-ધર્મ વિના આત્મ-પદાર્થ સિદ્ધ થતો નથી અને પોતાની સત્તા-પ્રમાણ વસ્તુ છે, દ્રવ્ય-અપેક્ષાએ ત્રણોમાં ભેદ નથી એક જ છે. ૧૧.

આત્મા નિત્ય છે. (સવૈયા એકત્રીસા)

જ્યોं કલધૌત સુનારકી સંગતિ,  
ભૂષન નામ કહૈ સબ કોઈ।  
કંચનતા ન મિટી તિહિ હેતુ,  
વહૈ ફિરિ ઔટિકૈ કંચન હોઈ॥  
ત્યોં હેડાનંદ.  
ભયૌ બહુરૂપ ભયૌ નહિ દોઈ।  
ચેતનતા ન ગઈ કબહૂં,  
તિહિ કારન બ્રહ્મ કહાવત સોઈ॥૧૨॥

શાલાર્થ :—કલધૌત=સોનું. ભૂષન=ઘરેણું. ઔટિત=ગાળવાથી. બ્રહ્મ=નિત્ય આત્મા.

અર્થ :—જેવી રીતે સોની દ્વારા ઘડવામાં આવતું સોનું ઘરેણાંના રૂપમાં થઈ જાય છે, પણ ગાળવાથી પાછું સોનું જ કહેવાય છે, તેવી જ રીતે આ જીવ અજીવરૂપ કર્મના નિભિતે અનેક વેષ ધારણ કરે છે, પણ અન્યરૂપ થઈ જતો નથી કારણ કે ચૈતન્યનો ગુણ ક્યાંય ચાલ્યો જતો નથી, એ જ કારણે જીવને સર્વ અવસ્થાઓમાં બ્રહ્મ કહે છે. ૧૨.

સુભુદ્ધિ સખીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે.  
(સવૈયા એકત્રીસા)

દેખુ સખી યહ બ્રહ્મ વિરાજિત,  
યાકી દસા સબ યાહીકૌ સોહૈ।  
એકમૈં એક અનેક અનેકમૈં,  
દુંદ લિયૈં દુવિધામહ દો હૈ॥  
આપુ સંભારિ લખૈ અપનૌ પદ,  
આપુ વિસારિકૈ આપુહિ મોહૈ।  
વ્યાપકરૂપ યહૈ ઘટ અંતર,  
ગ્યાનમૈં કૌન અગ્યાનમૈં કો હૈ॥૧૩॥

**શાલાર્થ :-** વિરાજિત=શોભાયમાન. દસા=પરિણાતિ. વિસારિકૈ=ભૂલીને.

**અર્થ :-** સુભુદ્ધિ સખીને કહે છે કે હે સખી ! જો, આ પોતાનો ઈશ્વર સુશોભિત  
છે, તેની સર્વ પરિણાતિ તેને જ શોભા આપે છે, એવી વિચિત્રતા બીજા કોઈમાં નથી.  
એને આત્મસત્તામાં જુઓ તો એકરૂપ છે, પરસત્તામાં જુઓ તો અનેકરૂપ છે,  
જ્ઞાનદશામાં જુઓ તો જ્ઞાનરૂપ, અજ્ઞાનદશામાં જુઓ તો અજ્ઞાનરૂપ, આવી બંને  
દુવિધાઓ એમાં છે. કોઈવાર સચેત થઈને પોતાની શક્તિની સંભાળ કરે છે અને  
કોઈવાર પ્રમાદમાં પડીને પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, પણ એ ઈશ્વર નિજઘટમાં  
વ્યાપક રહે છે, હવે વિચાર કરો કે જ્ઞાનરૂપ પરિણામન કરનાર કોણ છે અને  
અજ્ઞાનદશામાં વર્તનાર કોણ છે ? અર્થાત્ તે જ છે. ૧૩.

આત્મ-અનુભવનું દાખાંત (સવૈયા તેવીસા)

જ્યૌં નટ એક ધરૈ બહુ ભેખ,  
કલા પ્રગતૈ બહુ કૌતુક દેખૈ।  
આપુ લખૈ અપની કરતૂતિ,  
વહૈ નટ ભિન્ન વિલોકત ભેખૈ॥

ત્યૌં ઘટમૈં નટ ચેતન રાવ,  
વિભાઉ દસા ધરિ રૂપ વિસેખૈ।  
ખોલિ સુદૃષ્ટિ લખૈ અપનોં પદ,  
દુંદ વિચારિ દસા નહિ લેખૈ॥૧૪॥

**અર્થ :**—જેવી રીતે નટ અનેક સ્વાંગ ધારે છે અને તે સ્વાંગના તમાશા જોઈને લોકો કુતૂહલ સમજે છે, પણ તે નટ પોતાની અસલીરૂપથી કૃત્રિમ ધારણ કરેલા વેષને ભિન્ન જાણો છે, તેવી જ રીતે આ નટરૂપ ચેતનરાજ પરદ્રવ્યના નિમિત્તે અનેક વિભાવપર્યાયોને પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે અંતરંગદર્શિ ખોલીને પોતાનું રૂપ દેખે છે ત્યારે અન્ય અવસ્થાઓને પોતાની માનતો નથી. ૧૪.

હેય-ઉપાદેય ભાવો ઉપર ઉપદેશ (છંદ અડિલ)

જાકે ચેતન ભાવ, ચિદાનંદ સોડે હૈ।  
ઓર ભાવ જો ધરે, સૌ ઔરો કોડે હૈ॥  
જો ચિનમંડિત ભાઉ, ઉપાદે જાનનૈં  
ત્યાગ જોગ પરભાવ, પરાયે માનનૈં॥૧૫॥

**શાલાર્થ :**—ચિદાનંદ=ચેતનવંત આત્મા. ઉપાદે (ઉપાદેય)=ગ્રહણ કરવાને યોગ્ય. હેય=ત્યાગવાને યોગ્ય. પરાયે=બીજા. માનનૈ=શ્રદ્ધા કરવી જોઈએ.

**અર્થ :**—જેમાં ચૈતન્યભાવ છે તે ચિદાત્મા છે અને જેમાં અન્યભાવ છે તે બીજ જ અર્થાત્ અનાત્મા છે. ચૈતન્યભાવ ઉપાદેય છે, પરદ્રવ્યઓના ભાવ પર છે—ત્યાગવા યોગ્ય છે. ૧૫.

જ્ઞાની જીવ ચાહે ઘરમાં રહે, ચાહે વનમાં રહે, પણ મોક્ષમાર્ગ સાધે છે.

(સવૈયા એકત્રીસા)

જિન્હકેં સુમતિ જાગી ભોગસૌં ભયે વિરાગી,  
પરસંગ ત્યાગિ જે પુરુષ ત્રિભુવનમૈં।

એકશ્ચિતશ્ચિન્મય એવ ભાવો ભાવાઃ પરે યે કિલ તે પરેષામ્ ।

ગ્રાહસ્તતશ્ચિન્મય એવ ભાવો ભાવાઃ પરે સર્વત એવ હેયાઃ ॥૧૫॥

રાગાદિક ભાવનિસૌં જિનિકા રહનિ ન્યારી,  
 કબહું મગન હૈ ન રહેં ધામ ધનમૈં ॥  
 જે સદૈવ આપકૌં વિચારેં સરવાંગ સુદ્ધ,  
 જિન્હકૈ વિકલતા ન વ્યાપૈ કહું મનમૈં ।  
 તેઈ મોખ મારગકે સાધક કહાવૈં જીવ,  
 ભાવૈ રહૌ મંદિરમૈં ભાવૈ રહૌ વનમૈં ॥૧૬॥

**શાબ્દાર્થ :**—સુભતિ=સારી બુદ્ધિ. જાગી=પ્રગટી. પરસંગ ત્યાગી=દેહ આદિથી મમત્વનો ત્યાગ કરનારા. ત્રિભુવન=ત્રણ લોક—ઉર્ધ્વ, મધ્ય, પાતાળ. સરવાંગ (સર્વાંગ)=પૂર્ણ રીતે. વિકલતા=અમ. ભાવૈ=ચાહે તો. મંદિરમૈં=ધરમાં

**અર્થ :**—જેમને સુખુદ્ધિનો ઉદ્ય થયો છે, જે ભોગોથી વિરક્ત થયા છે, જેમણે શરીર આદિ પરદવ્યોનું મમત્વ દૂર કર્યું છે, જે રાગ-દ્રેષ આદિભાવોથી રહિત છે, જે કદી ધર અને ધન-સંપત્તિ આદિમાં લીન થતાં નથી, જે સદા પોતાના આત્માને સમ્પૂર્ણ રીતે શુદ્ધ વિચારે છે, જેમને મનમાં કદી આકૃષ્ણતા વ્યાપ્તિ નથી, તે જ જીવો ત્રણલોકમાં<sup>૧</sup> મોક્ષમાર્ગના સાધક છે, ભલે તેઓ ધરમાં રહે કે જંગલમાં રહે. ૧૬.

મોક્ષમાર્ગી જીવોની પરિણતિ (સવૈયા તેવીસા)  
 ચેતન મંડિત અંગ અખંડિત,  
 સુદ્ધ પવિત્ર પદારથ મેરો ।  
 રાગ વિરોધ વિમોહ દસા,  
 સમુદ્ધૈ બ્રમ નાટક પુદ્ગલ કેરો ॥

૧. ચાહે તેઓ ઉર્ધ્વલોક અથવા દેવગતિમાં હોય, મધ્યલોક અર્થાત् તિર્યંચ જાતિમાં હોય કે પછી પાતાળલોક અર્થાત્ ભવનવાસી, વ્યંતર કે નરકગતિમાં હોય.

સિદ્ધાન્તોઽયમુદાત્તચિત્તચરિતૈર્મોક્ષાર્થભિ:  
 શુદ્ધ ચિન્મયમેકમેવ પરમ જ્યોતિઃ સદૈવાસ્યહમ् ।  
 એતે યે તુ સમુલ્લસન્તિ વિવિધા ભાવાઃ પૃથગ્લક્ષણા-  
 સ્તોત્રાં નાસ્મિ યતોઽત્ર તે મમ પરદ્રવ્ય સમગ્રા અપિ ॥૬॥

ભોગ સંયોગ વિયોગ બિથા,  
અવલોકિ કહૈ યહ કર્મજ ઘેરો।  
હૈ જિન્હકૌ અનુભૌ ઇહ ભાંતિ,  
સદા તિનકોં પરમારથ નેરો ॥૧૭॥

શાન્દાર્થ :—મંડિત=શોભિત. અખંડિત=જે છેદાતો—ભેદાતો નથી તે.

અર્થ :—જેઓ વિચારે છે કે મારો આત્મપદાર્થ ચૈતન્યરૂપ છે, અછેદ, અભેદ, શુદ્ધ અને પવિત્ર છે, જે રાગ-દ્રેષ્ટ-મોહને પુદ્ગળનું નાટક સમજે છે, જે ભોગ-સામગ્રીના સંયોગ અને વિયોગની આપત્તિઓને જોઈને કહે છે કે આ કર્મજનિત છે—એમાં આપણું કંઈ નથી, એવો અનુભવ જેમને સદા રહે છે, તેમની સમીપ જ મોક્ષ છે. ૧૭.

સમ્યગ્દૃષ્ટિ જીવ સાધુ છે અને મિથ્યાદૃષ્ટિ જીવ ચોર છે. (દોહરા)

જો પુમાન પરધન હૈર, સો અપરાધી અગ્ય।  
જો અપનૌ ધન વ્યોહરૈ, સો ધનપતિ સરવગ્ય ॥૧૮॥  
પરકી સંગતિ જૌ રચૈ, બંધ બઢાવૈ સોડું।  
જો નિજ સત્તામે મગન, સહજ મુક્ત સો હોડું ॥૧૯॥

શાન્દાર્થ :—પુમાન=મનુષ્ય પરધન હૈર=પરદ્રવ્યને અંગીકાર કરે છે. અગ્ય=મૂર્ખ. ધનપતિ=શાહૂકાર. રચૈ=લીન થાય.

અર્થ :—જે મનુષ્ય પરદ્રવ્યનું હરણ કરે છે તે મૂર્ખ છે, ચોર છે, જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે સમજણો છે, શાહૂકાર છે. ૧૮. જે પરદ્રવ્યની સંગતિમાં મળન રહે છે તે બંધની પરંપરા વધારે છે અને જે નિજસત્તામાં લીન રહે છે તે

પરદ્રવ્યગ્રહં કુર્વન् બધેતૈવાપરાધવાન् ।  
બધેતાનપરાધો ન સ્વદ્રવ્યે સંવૃતો યતિ: ॥૧॥  
અનવરતમનન્તર્બધ્યતે સાપરાધ:  
સ્પૃશતિ નિરપરાધો બન્ધન નૈવ જાતુ ।  
નિયતમયમશુદ્ધ સ્વં ભજન્સાપરાધો  
ભવતિ નિરપરાધ: સાધુ શુદ્ધાત્મસેવી ॥૮॥

સહજમાં જ મોક્ષ પામે છે. ૧૮.

**ભાવાર્થ :**—લોકમાં પ્રવૃત્તિ છે કે ને બીજાનું ધન લે છે તેને અજ્ઞાની ચોર અથવા ડાઢું કહેવામાં આવે છે, તે ગુનેગાર અને દંડને પાત્ર થાય છે અને જે પોતાના ધનનો ઉપયોગ કરે છે તે મહાજન અથવા સમજદાર કહેવાય છે, તેની પ્રશંસા કરવામાં આવે છે. તેવી જ રીતે જીવ પરદ્રવ્ય અર્થાત્ શરીર કે શરીરના સંબંધી ચેતન-અચેતન પદાર્થોને પોતાના માને છે અથવા તેમાં લીન થાય છે તે મિથ્યાત્વી છે, સંસારનું દુઃખ ભોગવે છે અને જે નિજાત્માને પોતાનો માને છે અથવા તેનો જ અનુભવ કરે છે તે જ્ઞાની છે, મોક્ષનો આનંદ પામે છે. ૧૮. ૧૮.

દ્રવ્ય અને સત્તાનું સ્વરૂપ (દોહરા)

ઉપજૈ વિનસૈ થિર રહૈ, યહ તો વસ્તુ વખાન।

જો મરજાદા વસ્તુકી, સો સત્તા પરવાંન ॥૨૦॥

**શાલાર્થ :**—ઉપજૈ=ઉત્પન્ન થાય. વિનસૈ=નાણ થાય. વસ્તુ=દ્રવ્ય. મર્યાદા=સીમા, ક્ષેત્રાવગાઠ. પરવાંન (પ્રમાણ)=જાણવું.

**અર્થ :**—જે પર્યાયોથી ઉત્પન્ન અને નાણ થાય છે પણ સ્વરૂપે સ્થિર રહે છે તેને દ્રવ્ય કહે છે, અને દ્રવ્યના ક્ષેત્રાવગાઠને સત્તા કહે છે. ૨૦.

છ દ્રવ્યની સત્તાનું સ્વરૂપ (સર્વૈયા એકશ્રીસા).

લોકાલોક માન એક સત્તા હૈ આકાશ દર્વ,

ધર્મ દર્વ એક સત્તા લોક પરમિતિ હૈ।

લોક પરવાન એક સત્તા હૈ અધર્મ દર્વ,

કાલકે અનૂ અસંખ સત્તા અગનિતિ હૈ॥

પુદ્ગલ સુદ્ધ પરવાનુકી અનંત સત્તા,

જીવકી અનંત સત્તા ન્યારી ન્યારી છિતિ હૈ।

કોઊ સત્તા કાબૂસોં ન મિલિ એકમેક હોઇ,

સવૈ અસહાય યોં અનાદિહીકી થિતિ હૈ॥૨૧॥

**શાબ્દાર્થ :-** લોકલોક=સર્વ આકાશ. પરમિતિ=બરાબર. પરવાન(પ્રમાણ)=બરાબર. અગનિતિ=અસંખ્યાત. ન્યારી ન્યારી=જુદી જુદી થિતિ (સ્થિતિ)=હ્યાતી. અસહાય=સ્વાધીન.

**અર્થ :-** આકાશદ્રવ્ય એક છે, તેની સત્તા લોક-અલોકમાં છે, ધર્મ દ્રવ્ય એક છે, તેની સત્તા લોક-પ્રમાણ છે, અધર્મદ્રવ્ય પણ એક છે, તેની સત્તા લોક-પ્રમાણ છે, કાળના અણુ અસંખ્યાત છે, તેની સત્તા અસંખ્યાત છે, પુદ્ગલ દ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે, જીવદ્રવ્ય અનંતાનંત છે, તેની સત્તા અનંતાનંત છે, આ છેએ દ્રવ્યોની સત્તાઓ જુદી જુદી છે, કોઈ સત્તા કોઈની સાથે મળતી નથી અને એકમેક થતી નથી. નિશ્ચયનયમાં કોઈ કોઈને આશ્રિત નથી સર્વ સ્વાધીન છે. આ પ્રમાણે અનાદિકાળથી ચાલતું આવ્યું છે. ૨૧.

જ દ્રવ્યથી જ જગતની ઉત્પત્તિ છે. (સવૈયા એકત્રીસા)

એડ છહોં દર્વ ઇનહીકૌ હૈ જગતજાલ,  
તામેં પાંચ જડ એક ચેતન સુજાન હૈ।  
કાહૂકી અનંત સત્તા કાહૂસૌં ન મિલૈ કોઇ,  
એક એક સત્તામેં અનંત ગુન ગાન હૈ॥  
એક એક સત્તામેં અનંત પરજાઇ ફિરૈ,  
એકમૈં અનેક ઇહિ ભાંતિ પરવાન હૈ।  
યહૈ સ્યાદવાદ યહૈ સંતનિકી મરજાદ,  
યહૈ સુખ પોખ યહ મોખકૌ નિદાન હૈ॥૨૨॥

**શાબ્દાર્થ :-** જગતજાલ=સંસાર. સુજાન=જ્ઞાનમય. સંતનકી=સત્પુરુષોની. મરજાદ=સીમા. પોખ=પુષ્ટિ કરનાર. નિદાન=કારણ.

**અર્થ :-** ઉપર કહેલા જ છ દ્રવ્યો છે, એમનાથી જ જગત ઉત્પન્ન છે. આ છ દ્રવ્યોમાં પાંચ અચેતન છે, એક ચેતનદ્રવ્ય જ્ઞાનમય છે. કોઈની અનંતસત્તા કોઈની સાથે કદી મળતી નથી. પ્રત્યેક સત્તામાં અનંત ગુણસમૂહ છે અને અનંત અવસ્થાઓ છે, આ રીતે એકમાં અનેક જ્ઞાનવા. એ જ સ્યાદ્વાદ છે, એ જ સત્પુરુષોનું અખંડિત કથન છે. એ જ આનંદવર્ધક છે અને એ જ જ્ઞાન મોક્ષનું કારણ છે. ૨૨.

(સવૈયા એકત્રીસા)

સાધી દધિ મંથમેં અરાધી રસ પંથનિમેં,  
જહાં તહાં ગ્રંથનિમેં સત્તાહીકૌ સોર હૈ।  
ગ્યાન ભાન સત્તામેં સુધા નિધાન સત્તાહીમેં,  
સત્તાકી દુરનિ સાંજી સત્તા મુખ ભોર હૈ॥  
સત્તાકૌ સરૂપ મોખ સત્તા ભૂલ યહૈ દોષ,  
સત્તાકે ઉલંઘે ધૂમધામ ચહું વોર હૈ।  
સત્તાકી સમાધિમેં વિરાજિ રહૈ સોઈ સાહૂ,  
સત્તાતૈં નિકસિ ઔર ગહૈ સોઈ ચોર હૈ॥૨૩॥

**શાલાર્થ :-**—દધિ=દહીં. મંથમેં=વલોવવામાં. રસ પંથ=રસનો ઉપાય. સોર (શોર)=આંદોલન. સત્તા=વસ્તુનું અસ્તિત્વ, મોજુદગી. ધૂમધામ ચહું વોર=ચાર ગતિમાં અમણ. સમાધિ=અનુભવ. સાહૂ=ભલો માણસ. ગહૈ=ગ્રહણ કરે.

**અર્થ :-**—દહીંના મંથનથી ધીની સત્તા સાધવામાં આવે છે, ઔષધિઓની કિયામાં રસની સત્તા છે, શાસ્ત્રોમાં જ્યાં-ત્યાં સત્તાનું જ કથન છે, જ્ઞાનનો સૂર્ય સત્તામાં છે, અમૃતનો પુંજ સત્તામાં છે, સત્તાને છુપાવવી એ સાંજના<sup>૧</sup> અંધકાર સમાન છે અને સત્તાને મુખ્ય કરવી એ સવારના<sup>૨</sup> સૂર્યનો ઉદ્ય કરવા સમાન છે. સત્તાનું સ્વરૂપ જ મોક્ષ છે, સત્તાનું ભૂલવું તે જ જન્મ-મરણ આદિ દોષરૂપ સંસાર છે, પોતાની આત્મસત્તાનું ઉલ્લંઘન કરવાથી ચાર ગતિમાં ભટકવું પડે છે. જે આત્મસત્તાના અનુભવમાં વિરાજમાન છે તે જ ભલો માણસ છે અને જે આત્મસત્તા છોડીને અન્ય સત્તાનું ગ્રહણ કરે છે તે જ ચોર છે. ૨૩.

આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. (સવૈયા એકત્રીસા)

જામેં લોકવેદ નાંહિ થાપના ઉછેદ નાંહિ,  
પાપ પુત્ર ખેદ નાંહિ ક્રિયા નાંહિ કરની।

૧-૨. સાંજના અંધકારનો ભાવ એ જણાય છે કે અજ્ઞાનનો અંધકાર વધતો જાય. પ્રભાતના સૂર્યોદયનો એ ભાવ જણાય છે કે જ્ઞાનનો પ્રકાશ વધતો જાય.

जामैं राग दोष नांहि जामैं बंध मोख नांहि,  
 जामैं प्रभु दास न अकास नांहि धरनी ॥  
 जामैं कुल रीत नांहि जामैं हारि जीत नांहि,  
 जामैं गुरु सीष नांहि, वीष नांहि भरनी ।  
 आश्रम बरन नांहि काहूकी सरन नांहि  
 ऐसी सुद्ध सत्ताकी समाधिभूमि बरनी ॥२४॥

**શાન્દાર્થ** :—લોકવેદ=લોકિક જ્ઞાન. થાપના ઉછેદ=લોકિક વાતોનું ખંડન. (જેમ મૂર્તિને ઈશ્વર કહેવા એ લોકવ્યવહાર છે અને મૂર્તિપૂજાનું ખંડન કરવું તે લોકસ્થાપનાનો ઉચ્છેદ કરવા બારાબર છે. સત્તામાં તે બંને નથી.) ખેદ=કષ્ટ. પ્રભુ=સ્વામી. દાસ=સેવક. ધરની=પૃથ્વી. વીજ ભરની=યાત્રા પૂરી કરવી. બરન આશ્રમ (વર્ણ આશ્રમ)=બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂક્ર એ ચાર.

અર્થ :—જેમાં લોકિક રીતરિવાજોની ન વિધિ છે કે ન નિષેધ છે, ન પાપ-પુષ્યનો કલેશ છે, ન કિયાની આજ્ઞા છે, ન રાગ-દ્વેષ છે, ન બંધ-મોક્ષ છે, ન સ્વામી છે, ન સેવક છે, ન આકાશ<sup>૧</sup> છે ન ધરતી<sup>૨</sup> છે, ન કુળાચાર છે, ન હારજીત છે, ન ગુરુ છે ન શિષ્ય છે, ન હાલવું—ચાલવું છે, ન વર્ણાશ્રમ છે, ન કોઈનું શરણ છે. એવી શુદ્ધ સત્તા અનુભવરૂપ ભૂમિમાં પ્રાપ્ત થાય છે. ૨૪.

જે આત્મસત્તાને જાણતો નથી તે અપરાધી છે. (દોહરા)

जाकै घट समता नहीं, ममता मगन सदीव ।

रमता राम न जानई, सो अपराधी जीव ॥२५॥

अपराधी मिथ्यामती, निरदै हिरदै अंध ।

परकौं मानै आतमा, करै करमकौं बंध ॥२६॥

झटी करनी आचरै, झटे सखकी आस।

झਾਠੀ ਭਗਤਿ ਹਿਏ ਧਰੈ, ਝਾਟੇ ਪ੍ਰਭਕੌ ਦਾਸ।

ପ୍ରକାଶକ ନାମ : ପାତ୍ରି

---

जता हता- प्रनादना पता- तुखातान्ता प्रलाप वापलुम्बूलतानालवन् ।  
आत्मन्येवालानितं च चित्तमासंपूर्णविज्ञानघनोपलब्धे: ॥१॥

**શાલાર્થ :**—સમતા=રાગ-દ્રેષરહિત ભાવ. મમતા=પરદવ્યોમાં અહંબુદ્ધિ. રમતા રામ=પોતાના રૂપમાં આનંદ કરનાર આત્મારામ. અપરાધી=દોષી. નિરદૈ(નિર્દય)=દુષ્ટ. હિરદૈ(હદય)=મનમાં. આસ(આશા)=ઉમેદ. ભગતિ(ભક્તિ)=સેવા, પૂજા. દાસ=સેવક.

**અર્થ :**—જેના હદયમાં સમતા નથી, જે સદા શરીર આદિ પરપદાર્થોમાં મળ્ય રહે છે અને પોતાના આત્મારામને જાણતો નથી તે જીવ અપરાધી છે. ૨૫. પોતાના આત્મસ્તવરૂપને નહીં જાણનાર અપરાધી જીવ મિથ્યાત્વી છે, પોતાના આત્માનો હિંસક છે, હદયનો અંધ છે. તે શરીર આદિ પદાર્થોને આત્મા માને છે અને કર્મબંધને વધારે છે. ૨૬. આત્મજ્ઞાન વિના તેનું તપાચરણ મિથ્યા છે. તેની મોક્ષસુખની આશા જૂઠી છે, ઈશ્વરને જાણ્યા વિના ઈશ્વરની ભક્તિ અથવા દાસત્વ મિથ્યા છે. ૨૭.

મિથ્યાત્વની વિપરીત વૃત્તિ (સવૈયા એકગ્રીસા)

માટી ભૂમિ સૈલકી સો સંપદા બખાનૈ નિજ,  
 કર્મમૈં અમૃત જાનૈ ગ્યાનમૈં જહર હૈ।  
 અપનાં ન રૂપ ગહૈ ઔરહીસૌં આપૌ કહૈ,  
 સાતા તો સમાધિ જાકૈ અસાતા કહર હૈ॥  
 કોપકૌ કૃપાન લિએ માન મદ પાન કિયૈ,  
 માયાકી મરોર હિયૈ લોભકી લહરું હૈ,  
 યાહી ભાંતિ ચેતન અચેતનકી સંગતિસૌં,  
 સાંચસૌં વિમુખ ભયૌ ઝૂઠમૈં બહર હૈ॥૨૮॥

**શાલાર્થ :**—સૈલ(શૈલ)=પર્વત. જહર=વિષ. ઔરહિસૌં=પરદવ્યથી. કહર=આપત્તિ. કૃપાન=તલવાર. બહર હૈ=લાગી પડ્યો છે.

**અર્થ :**—સોનું—ચાંદી જે પહાડોની માટી છે તેને પોતાની સંપત્તિ કહે છે, શુભકિયાને અમૃત માને છે અને જ્ઞાનને જેર જાણે છે. પોતાના આત્મરૂપનું ગ્રહણ કરતો નથી, શરીર આદિને આત્મા માને છે, શાતાવેદનીયજનિત લૌકિક-સુખમાં આનંદ માને છે અને અશાતાના ઉદ્યને આઝિત કહે છે, કોધની તલવાર પકડી રાખી છે, માનનો શરાબ પીને બેઠો છે, મનમાં માયાની વક્તા છે અને લોભના ચક્કરમાં પડેલો

છે. આ રીતે અચેતનની સંગતિથી ચિદ્રૂપ આત્મા સત્યથી પરાજુખ થઈને જૂઠમાં જ ગુંચવાઈ ગયો છે. ૨૮.

(સવૈયા એકત્રીસા)

તીન કાલ અતીત અનાગત વરતમાન,  
જગમેં અખંડિત પ્રવાહકૌ ડહર હૈ।  
તાસૌ કહૈ યહ મેરૌ દિન યહ મેકી રાતિ,  
યહ મેરી ધરી યહ મેરોહી પહર હૈ॥  
ખેહકૌ ખજાનૌ જોરૈ તાસૌ કહે મેરૌ ગેહ,  
જહાં બસૈ તાસૌ કહૈ મેરોહી સહર હૈ।  
યાહિ ભાંતિ ચેતન અચેતનકી સંગતિસૌ,  
સાંચસૌ વિમુખ ભ્યૌ ઝૂઠમેં બહર હૈ॥૨૯॥

શાલાર્થ :—અતીતકાલ=ભૂતકાળ. અનાગત=ભવિષ્ય. ખેહ=કચરો. ગેહ=ઘર.

સહર(શહર)=નગર.

અર્થ :—સંસારમાં ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું ધારા-પ્રવાહ ચક ચાલી રહ્યું છે, તેને કહે છે કે મારો દિવસ, મારી રાત્રિ, મારી ધરી, મારો પહોર છે. કચરાનો ઢગલો ભેગો કરે છે અને કહે છે કે આ મારું મકાન છે, જે પૃથ્વીના ભાગમાં રહે છે તેને પોતાનું નગર બતાવે છે. આ રીતે અચેતનની સંગતિથી ચિદ્રૂપ આત્મા સત્યથી પરાજુખ થઈને જૂઠમાં મુંઝાઈ રહ્યો છે. ૨૮.

સમ્યગૃદ્ધિ જીવોનો સદ્વિચાર (દોહરા)

જિન્હે મિથ્યામતિ નહી, ગ્યાનકલા ઘટ માંહિ।  
પરચૈ આત્મરામસો, તે અપરાધિ નાંહિ॥૩૦॥

શાલાર્થ :—મિથ્યામતી=ખોટી બુદ્ધિ. પરચૈ(પરિચય)=ઓળખાણ.

અર્થ :—જે જીવોની કુબુદ્ધિ નાચ થઈ ગઈ છે, જેમના હદ્યમાં જ્ઞાનનો પ્રકાશ છે અને જેમને આત્મસ્વરૂપની ઓળખાણ છે તે ભલા માણસ છે. ૩૦.

(સવૈયા એકત્રીસા)

જિન્હકે ધરમ ધ્યાન પાવક પ્રગટ ભયો,  
સંસૈ મોહ વિભ્રમ બિરખ તીનોં ડઢે હૈને।  
જિન્હકી ચિતૌનિ આગે ઉડૈ સ્વાન ભૂસિ ભાગે,  
લાગૈ ન કરમ રજ ગ્યાન ગજ ચઢે હૈને॥  
જિન્હકી સમુદ્ધિકી તરંગ અંગ આગમમે,  
આગમમેં નિપુન અધ્યાત્મમેં કઢે હૈને।  
તેઈ પરમારથી પુનીત નર અઠોં જામ,  
રામ રસ ગાડ કરૈ યહૈ પાઠ પઢે હૈને॥૩૧॥

શાન્દાર્થ :-પાવક=અજિન. બિરખ (વૃક્ષ)=આડ. શ્થન=કૂતરો. ૨જ=ધૂળ. ગ્યાન=જ્ઞાનરૂપી હાથી. અધ્યાત્મ=આત્માનું સ્વરૂપ બતાવનારી વિદ્યા. પરમારથી (પરમારથી)=પરમ પદાર્થ અર્થાત્ મોક્ષના માર્ગમાં લાગેલા. પુનીત=પવિત્ર. આઠોં જામ=આઠેય પહોર-સદાકાળ.

અર્થ :-જેમની ધર્મધ્યાનરૂપ અજિનમાં સંશય, વિમોહ અને વિભ્રમ એ ત્રણે વૃક્ષ બળી ગયાં છે, જેમની સુદૃષ્ટિ આગળ ઉદ્યરૂપી કૂતરા ભસતાં ભસતાં ભાગી જાય છે, તેઓ જ્ઞાનરૂપી હાથી ઉપર બેઠેલા છે, તેથી કર્મરૂપી ધૂળ તેમના સુધી પહોંચતી નથી. જેમના વિચારમાં શાખજાનની લહેરો ઉઠે છે, જે સિદ્ધાંતમાં પ્રવીણ છે, જે આધ્યાત્મિક વિદ્યાના પારગામી છે, તેઓ જ મોક્ષમાર્ગી છે-તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણે છે. ૩૧.

(સવૈયા એકત્રીસા)

જિન્હકી ચિહુંટિ ચિમટાસી ગુન ચૂનિબેકોં,  
કુકથાકે સુનિબેકોં દોઊ કામ મઢે હૈને।  
જિન્હકૌ સરલ ચિત્ત કોમલ વચન બોલૈ,  
સોમદૃષ્ટિ લિયૈં ડોલેં મોમ કેસે ગઢે હૈને॥  
જિન્હકી સકતિ જગી અલખ અરાધિબેકોં,  
પરમ સમાધિ સાધિબૈકોં મન બઢે હૈને।

તેઈ પરમારથી પુનીત નર આઈં જામ,  
રામ રસ ગાડ કરૈ યહૈ પાઠ પઢે હૈનું ॥૩૨॥

શાલાર્થ :—ચિહુંટિ=બુદ્ધિ. ચૂનિબેકૌ=પકડવાને—ગ્રહણ કરવાને. કુકથા=ખોટી વાર્તા—સ્વીકથા આદિ. સોમદંસિ=કોષ આદિ રહિત. અલખ=આત્મા.

અર્થ :—જેમની બુદ્ધિ ગુણ ગ્રહણ કરવામાં ચીપિયા<sup>૧</sup> જેવી છે, વિકથા સાંભળવાને માટે જેમના કાન મઢેલા અર્થાત્ બહેરા છે, જેમનું ચિત્ત નિષ્કપટ છે, જે મૃદુ ભાષણ કરે છે, જેમની કોષાદિ રહિત સૌભ્યદંસિ છે, જે એવા કોમળ સ્વભાવવાળા છે કે જાણે મીણના<sup>૨</sup> જ બનેલા છે, જેમને આત્મધ્યાનની શક્તિ પ્રગટ થઈ છે અને પરમ સમાધિ સાધવાને જેમનું ચિત્ત ઉત્સાહી રહે છે, તેઓ જ મોક્ષમાર્ગી છે, તેઓ જ પવિત્ર છે, સદા આત્મ-અનુભવનો રસ દૃઢ કરે છે અને આત્મ-અનુભવનો જ પાઠ ભણો છે—અર્થાત્ આત્માનું જ રટણ લાગ્યું રહે છે. ઉર.

સમાધિ વર્ણાન (દોહરા)

રામ-રસિક અર રામ-રસ, કહન સુનનકૌં દોડું ।  
જવ સમાધિ પરગટ ભર્ઝ, તબ દુબિધા નહિ કોડું ॥૩૩॥

શાલાર્થ :—રામ-રસિક=આત્મા. રામ-રસ=અનુભવ. સમાધિ=આત્મામાં લીન થવું.  
દુબિધા=ભેદ.

અર્થ :—આત્મા અને આત્મ-અનુભવ એ કહેવા-સાંભળવામાં બે છે, પણ જ્યારે આત્મધ્યાન પ્રગટ થઈ જાય છે ત્યારે રસિક અને રસનો અથવા બીજો કોઈ ભેદ રહેતો નથી. ઉર.

૧. જેમ ચીપિયો નાની વસ્તુ પણ ઉપાડી લે છે તે જ રીતે સૂક્ષ્મ તત્ત્વોનું પણ તેમની બુદ્ધિ ગ્રહણ કરે છે.
૨. જેમ મીણ સહજમાં ઓગળી જાય છે અથવા વળી જાય છે તેમ તેઓ પણ થોડામાં જ કોમળ થઈ જાય છે, તત્ત્વની વાત થોડામાં જ સમજી જાય છે, પછી હઠ કરતા નથી.

યત્ર પ્રતિક્રમણમેવ વિષં પ્રણીતં  
તત્ત્વાપ્રતિક્રમણમેવ સુધા કુતઃ સ્યાત् ।  
તત્કિં પ્રમાયતિ જનઃ પ્રપતનધોર્ધઃ:  
કિં નોર્ધ્રમૂર્ધ્રમધિરોહતિ નિષ્પ્રમાદઃ ॥૧૦॥

શુભ કિયાઓનું સ્પષ્ટીકરણ (દોહરા)

નંદન બંદન થુતિ કરન, શ્રવન ચિંતવન જાપ।  
પઢન પઢાવન ઉપદિસન, બહુવિધિ ક્રિયા-કલાપ ॥૩૪॥

**શાસ્ત્રાર્થ :**—નંદન=રસિક અવસ્થાનો આનંદ. વંદન=નમસ્કાર કરવા. થુતિ(સ્તુતિ)=ગુણગાન કરવા. શ્રવન(શ્રવણ)=આત્મસ્વરૂપનો ઉપદેશ આદિ સાંભળવા. ચિંતવન=વિચાર કરવો. જાપ=વારંવાર નામનું ઉચ્ચારણ કરવું. પઠન=ભષણવું. પઢાવન=ભષણાવવું. ઉપદિસન=વ્યાખ્યાન દેવું.

**અર્થ :**—આનંદ માનવો. નમસ્કાર કરવા, સ્તવન કરવું, ઉપદેશ સાંભળવો, ધ્યાન કરવું, જાપ જપવો, ભષણવું, ભષણાવવું, વ્યાખ્યાન આપવું આદિ સર્વ શુભ કિયાઓ છે. ઉ૪.

શુભોપયોગમાં શુભોપયોગનો નિષેધ (દોહરા)

સુદ્રાતમ અનુભવ જહાં, સુભાચાર તહાં નાંહિ ।  
કરમ કરમ મારગ વિષે, સિવ મારગ સિવમાંહિ ॥૩૫॥

**શાસ્ત્રાર્થ :**—શુભાચાર=શુભ પ્રવૃત્તિ. કરમ મારગ (કર્મમાગ)=બંધનું કારણ. સિવ મારગ(શિવમાગ)=મોક્ષનું કારણ. સિવમાંહિ=આત્મામાં.

**અર્થ :**—ઉપર કહેલી કિયાઓ કરતાં કરતાં જ્યાં આત્માનો શુદ્ધ અનુભવ થઈ જાય છે ત્યાં શુભોપયોગ રહેતો નથી, શુભ કિયા કર્મબંધનું કારણ છે અને મોક્ષની પ્રાપ્તિ આત્મ-અનુભવમાં છે. ઉ૫.

વળી — (ચોપાઈ)

ઇહિ વિધિ વસ્તુવ્યવસ્થા જૈસી ।  
કહી જિનંદ કહી મૈં તૈસી ॥  
જે પ્રમાદસંજુત મુનિરાજા ।  
તિનકે સુભાચારસૌં કાજા ॥૩૬॥

**શાસ્ત્રાર્થ :**—વસ્તુવ્યવસ્થા=પદાર્થનું સ્વરૂપ. પ્રમાદસંજુત=આત્મ અનુભવમાં અસાવધાન, શુભોપયોગી.

અર્થ :—ગ્રંથકાર કહે છે કે આ રીતે પદાર્થનું જેવું સ્વરૂપ જિનરાજે કહ્યું છે તેવું અમે વર્ણવ્યું. જે મુનિરાજ પ્રમાદદશામાં રહે છે, તેમને શુભકિયાનું અવલંબન લેવું જ પડે છે. ઉદ્.

જહાં પ્રમાદ દસા નહિ વ્યાપૈ।  
તહાં અવલંબ આપનૌ આપૈ॥  
તા કારન પ્રમાદ ઉત્પાતી।  
પ્રગટ મોખ મારગકૌ ઘાતી॥૩૭॥

શાસ્ત્રાર્થ :—અવલંબ=આધાર.

અર્થ :—જ્યાં શુભ-અશુભ પ્રવૃત્તિરૂપ પ્રમાદ નથી રહેતો, ત્યાં પોતાને પોતાનું જ અવલંબન અર્થાત્ શુદ્ધોપયોગ હોય છે, તેથી સ્પષ્ટ છે કે પ્રમાદની ઉત્પત્તિ મોક્ષમાર્ગમાં બાધક છે. ઉ૭.

જે પ્રમાદ સંજુગત ગુસાઈ।  
ઉઠાં ગિરહિં ગિંદુકકી નાઈ॥  
જે પ્રમાદ તજિ ઉદ્ધત હૌંહીં।  
તિનકોં મોખ નિકટ દ્રિગ સૌંહીં॥૩૮॥

શાસ્ત્રાર્થ :—ગુસાઈ=સાધુ, ગિંદુક=દડો. નાઈ=જેમ. દ્રિગ=આંખ.

અર્થ :—જે મુનિ પ્રમાદ સહિત હોય છે તેઓ દડાની પેઠે નીચેથી ઉપર ચે અને પાછા નીચે પડે છે અને જે પ્રમાદ છોડીને સ્વરૂપમાં સાવધાન હોય છે, તેમની દષ્ટિમાં મોક્ષ બિલકુલ પાસે જ દેખાય છે.

વિશેષ :—સાધુદશામાં છદ્દું ગુણસ્થાનક પ્રમત્ત મુનિનું છે, તે છદ્દામાંથી સાતમામાં અને સાતમામાંથી છદ્દામાં અસંખ્યાત વાર ચે-ઉત્તરે છે. ઉ૮.

ઘટમૈ હૈ પ્રમાદ જબ તાઈ।  
પરાધીન પ્રાની તબ તાઈ॥  
જબ પ્રમાદકી પ્રભુતા નાસૈ।  
તબ પ્રધાન અનુભૌ પરગાસૈ॥૩૯॥

**શાન્દાર્થ :**—જબ તાઈ=જ્યાં સુધી. તબ તાઈ=ત્યાં સુધી. પ્રભુતા=બળ. નાસે(નાશૈ)=નાશ થાય. પ્રધાન=મુખ્ય. પરગાસે(પ્રકાશૈ)=પ્રગટ થાય.

**અર્થ :**—જ્યાં સુધી હદ્યમાં પ્રમાદ રહે છે ત્યાં સુધી જીવ પરાધીન રહે છે અને જ્યારે પ્રમાદની શક્તિ નાશ થઈ જાય છે ત્યારે શુદ્ધ અનુભવનો ઉદ્ય થાય છે. ૩૮.

વળી —  
(દોઢરા)

તા કારન જગપંથ ઇત, ઉત સિવ મારગ જોર।  
પરમાદી જગકૌં ધુકૈ, અપરમાદિ સિવ ઓર ॥૪૦॥

**શાન્દાર્થ :**—જગપંથ=સંસારભ્રમણનો ઉપાય. ઈત=અહીં. ઉત=ત્યાં. સિવમારગ (શિવમાર્ગ)=મોક્ષનો ઉપાય. ધુકૈ=દેખે. અપરમાદિ(અપ્રમાદિ)=પ્રમાદ રહિત.

**અર્થ :**—તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ દેખે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ દેખે છે. ૪૦.

જે પરમાદી આલસી, જિન્હું વિકલપ ભૂરિ।  
હોડ સિથલ અનુભૌવિષે, તિન્હું સિવપથ દૂરિ ॥૪૧॥

**શાન્દાર્થ :**—આલસી=નિરુધ્યમી. વિકલપ(વિકલ્પ)=રાગ-દ્રેષની લહેરો. ભૂરિ=ઘણી. સિથલ (શિથિલ)=અસર્મર્થ. સિવપથ=સ્વરૂપાચરણ.

**અર્થ :**—જે જીવ પ્રમાદી અને આણસુ છે જેમના ચિત્તમાં અનેક વિકલ્પો થાય છે અને જે આત્મ-અનુભવમાં શિથિલ છે, તેમનાથી સ્વરૂપાચરણ દૂર જ રહે છે. ૪૧.

જે પરમાદી આલસી, તે અભિમાની જીવ।  
જે અવિકલપી અનુભવી, તે સમરસી સદીવ ॥૪૨॥

**શાન્દાર્થ :**—અભિમાની=અહીંકાર સહિત. અવિકલપી(અવિકલ્પી)=રાગ-દ્રેષ રહિત.

પ્રમાદકલિત: કરં ભવતિ શુદ્ધભાવોઽલસ:  
કષાયભરગૌરવાદલસતા પ્રમાદો યત: ।  
અત: સ્વરસનિભરે નિયમિત: સ્વભાવે ભવન્  
મુનિ: પરમશુદ્ધતાં બ્રજતિ મુચ્યતે વાર્તચિરાત् ॥૭૭॥

અર્થ :—જે જીવ પ્રમાદ સહિત અને અનુભવમાં શિથિલ છે તેઓ શરીર આદિમાં અહંબુદ્ધિ કરે છે અને જે નિર્વિકલ્પ અનુભવમાં રહે છે તેમના ચિત્તમાં સદા સમતા-રસ રહે છે. ૪૨.

જે અવિકલપી અનુભવી, સુદ્ધ ચેતના યુક્ત।  
તે મુનિવર લઘુકાળમે, હૌહિ કરમસો મુક્ત ॥૪૩॥

શાસ્ત્રાર્થ :—સુદ્ધ ચેતના=શુદ્ધ જ્ઞાન-દર્શન.

અર્થ :—જે મુનિરાજ વિકલ્પ રહિત છે. અનુભવ અને શુદ્ધ જ્ઞાન-દર્શન સહિત છે, તેઓ થોડા જ સમયમાં કર્મરહિત થાય છે અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરે છે. ૪૩.

જ્ઞાનમાં સર્વ જીવ એકસરખા ભાસે છે.

(કવિત)

જેસેં પુરુષ લખૈ પરવત ચઢિ,  
ભૂચર-પુરુષ તાહિ લઘુ લગૈ।  
ભૂચર-પુરુષ લખૈ તાકોં લઘુ,  
ઉતરિ મિલૈં દુહુકૌ ભ્રમ ભગૈ ॥  
તૈસેં અભિમાની ઉત્ત્રત લગ,  
ઔર જીવકોં લઘુપદ દગૈ।  
અભિમાનીકોં કહૈ તુચ્છ સબ,  
ગ્યાન જગૈ સમતા રસ જગૈ ॥૪૪॥

શાસ્ત્રાર્થ :—ભૂચર=ધરતી પર રહેનાર. લઘુ=નાનો. ઉત્ત્રત લગ=ઉંચું મસ્તક રાખનાર.

અર્થ :—જેવી રીતે પર્વત પર ચડેલા મનુષ્યને નીચેનો મનુષ્ય નાનો દેખાય છે અને નીચેના મનુષ્યને પર્વત ઉપર ચડેલો મનુષ્ય નાનો દેખાય છે, પણ જ્યારે તે નીચે આવે છે ત્યારે બસ્તેનો ભ્રમ દૂર થઈ જાય છે અને વિષમતા મટી જાય છે, તેવી જ રીતે ઉંચું મસ્તક રાખનાર અભિમાની મનુષ્યને બધા મનુષ્યો તુચ્છ દેખાય છે અને

બધાને તે અભિમાની તુચ્છ દેખાય છે, પરંતુ જ્યારે જ્ઞાનનો ઉદ્ય થાય છે ત્યારે માન-  
ક્ષાય ગળી જવાથી સમતા પ્રગટ થાય છે. જ્ઞાનમાં કોઈ નાનું-મોટું દેખાતું નથી, સર્વ  
જીવો એકસરખા ભાસે છે. ૪૪.

અભિમાની જીવોની દશા (સવૈયા એકગ્રીસા)

કરમકે ભારી સમુદ્દ્રે ન ગુનકૌ મરમ,  
પરમ અનીતિ અધરમ રીતિ ગહે હૈને।  
હૌંહિ ન નરમ ચિત ગરમ ધરમહૂતૈં,  
ચરમકી દ્રિષ્ટિસૌં ભરમ ભૂલિ રહે હૈને॥  
આસન ન ખોલૈં મુખ વચન ન બોલૈં,  
સિર નાયે હૂં ન ડોલૈં માનોં પાથરકે ચહે હૈને।  
દેખનકે હાઉ ભવ પંથકે બઢાઉ એસે,  
માયાકે ખટાઉ અભિમાની જીવ કહે હૈને॥૪૫॥

**શાલાર્થ :**—કરમકે ભારી=અત્યંત કર્મબંધનવાળા. મરમ=રહસ્ય. અધરમ(અધમ)=પાપ.  
નરમ=કોમળ. ધરમ=તડકો. ચરમ દ્રિષ્ટિ (ચર્મદ્રિષ્ટિ)=ઇન્દ્રિયજનિત જ્ઞાન. ચહે(ચય)=જડેલા.  
હાઉ=ભયંકર. બઢાઉ=વધારનાર. ખટાઉ=મજબૂત.

**અર્થ :**—જેમણે કર્મોના તીવ્ર બંધ બાંધ્યા છે, જેઓ ગુણોનું રહસ્ય<sup>૧</sup> જાણતા  
નથી, અત્યંત અયોગ્ય અને પાપમય માર્ગનું ગ્રહણ કરે છે, કોમળ ચિત્તવાળા હોતા  
નથી. તડકાથી પણ અધિક ગરમી રહે છે અને ઇન્દ્રિય-જ્ઞાનમાં જ ભૂલી રહ્યા<sup>૨</sup> છે,  
દેખાડવા માટે એક આસને બેસી રહે છે અથવા ઊભા રહે છે, મૌન રહે છે, મહંત  
સમજને કોઈ નમસ્કાર કરે તો ઉત્તરમાં અંગ પણ હલાવતા નથી જાણે પત્થર જ  
ખોડ્યો હોય, દેખાવમાં ભયંકર છે, સંસારમાર્ગને વધારનાર છે, માયાચારમાં પાકા છે,  
એવા અભિમાની જીવ હોય છે.

૧. દોષને જ ગુણ સમજ જાય છે.

૨. આત્મજ્ઞાન થતું નથી.

જ્ઞાની જીવોની દશા (સવૈયા એકત્રીસા)

ધીરકે ધરૈયા ભવ નીરકે તરૈયા ભય,  
ભીરકે હરૈયા બરબીર જ્યો ઉમહે હૈને।  
મારકે મરૈયા સુવિચારકે કરૈયા સુખ,  
ઢારકે ઢરૈયા ગુન લૌસો લહલહે હૈને॥  
રૂપકે રિઝૈયા સબ નૈકે સમર્ઝૈયા સબ,-  
હીકે લઘુ ભૈયા સબકે કુબોલ સહે હૈને।  
બામકે બમૈયા દુખ દામકે દમૈયા એસે,  
રામકે રમૈયા નર ગ્યાની જીવ કહે હૈને॥૪૬॥

**શાલાર્થ :-**—ભનવીર=સંસાર-સમુદ્ર. ભીર=સમૂહ. બરભીર=મહાન યોદ્ધો. ઉમહે=ઉમંગ સહિત-ઉત્સાહિત. માર=કામની વાસના. લહલહે=લીલાછમ. રૂપકે રિઝૈયા=આત્મસ્વરૂપની રૂચિવાળા. લઘુ ભૈયા=નાના બનીને નમ્રતાપૂર્વક ચાલનાર. કુબોલ=કઠોર વચન. બામ=વક્તા. દુઃખ દામકે દમૈયા=દુઃખોની પરંપરાનો નાશ કરનાર. રામકે રમૈયા=આત્મસ્વરૂપમાં સ્થિર થનાર.

**અર્થ :-**—જે ધૈર્ય ધારણા કરનાર છે, સંસાર-સમુદ્રને તરનાર છે, સર્વ પ્રકારના ભયોનો નાશ કરનાર છે, મહાયોદ્ધા સમાન ધર્મમાં ઉત્સાહી રહે છે, વિષય-વાસનાઓને બાળી નાખે છે, આત્મહિતનું ચિંતવન કર્યા કરે છે, સુખ-શાંતિની ચાલ ચાલે છે, સદગુણોના પ્રકાશથી જગમગે છે, આત્મસ્વરૂપમાં રૂચિ રાખે છે, બધા નયોનું રહસ્ય જાણો છે, એવા ક્ષમાશીલ છે કે બધાના નાના ભાઈ બની રહે છે અથવા તેમની સારી-નરસી વાતો સહન કરે છે, હૃદયની કુટિલતા છોડીને સરળ ચિત્તવાળા થયા છે, દુઃખ સંતાપના માર્ગે ચાલતા નથી, આત્મસ્વરૂપમાં વિશ્રાંમ કર્યા કરે છે, એવા મહાનુભાવ જ્ઞાની કહેવાય છે. ૪૬.

સમ્યકૃત્વી જીવોનો મહિમા (ચોપાઈ)

જે સમકિતી જીવ સમચેતી ।  
તિનકી કથા કહોં તુમસેતી ॥

જહાં પ્રમાદ ક્રિયા નહિ કોઈ ।  
 નિરવિકલપ અનુભૌ પદ સોઈ ॥૪૭॥

પરિગ્રહ ત્યાગ જોગ થિર તીનોં ।  
 કરમ બંધ નહિ હોય નવીનોં ॥

જહાં ન રાગ દોષ રસ મોહૈ ।  
 પ્રગટ મોખ મારગ મુખ સોહૈ ॥૪૮॥

પૂર્બ બંધ ઉદય નહિ વ્યાપૈ ।  
 જહાં ન ભેદ પુત્ર અરુ પાપૈ ॥

દરબ ભાવ ગુન નિરમલ ધારા ।  
 બોધ વિધાન વિવિધ વિસ્તારા ॥૪૯॥

જિન્હુંકી સહજ અવસ્થા એસી ।  
 તિન્હુંકે હિરદૈ દુબિધા કેસી ॥

જે મુનિ છપક શ્રેણિ ચઢિ ધાયે ।  
 તે કેવળિ ભગવાન કહાયે ॥૫૦॥

**શાસ્ત્રાર્થ** :—સમયેતી=સમતા ભાવવાળા. કથા=વાર્તા. તુમસેતી=તમારાથી. પ્રમાદક્રિયા=શુભાચાર. જોગ થિર તીનોં=મન-વચન-કાયના યોગોનો નિગ્રહ. નવીનોં=નવો. પુત્ર(પુણ્ય)=શુભોપયોગ. દ્રવ્યભાવ=બાધા અને અંતરંગ. બોધિ=રત્નત્રય. છપકશ્રેણી=મોહકર્મનો નાશ કરવાની સીડી. ધાયે=ચઢે.

---

ત્વક્ત્વાઽશુદ્ધિવિધાયિ તત્કલ પરદ્રવ્ય સમગ્રં સ્વયં  
 સ્વદ્રવ્યે રતિમેતિ યઃ સ નિયતં સર્વાપરાધચ્યુતઃ ।  
 બન્ધધંસમુપેત્ય નિત્યમુદિતઃ સ્વજ્યોતિરચ્છોચ્છલ-  
 ચૈતન્યામृતપૂર્ણમહિમા શુદ્ધો ભવન્સુચ્યતે ॥૧૨॥

**અર્થ :**—હે ભવ્ય જીવો ! સમતા સ્વભાવના ધારક સમ્યગુદૃષ્ટિ જીવોની દશા તમને કહું છું, જ્યાં શુભાચારની પ્રવૃત્તિ નથી ત્યાં નિર્વિકલ્પ અનુભવપદ રહે છે. ૪૭. જે સર્વ પરિગ્રહ છોડીને મન-વચન-કાયાના ત્રણે યોગોનો નિગ્રહ કરીને બંધ-પરંપરાનો સંવર કરે છે, જેમને રાગ-દ્રેષ્ટ-મોહ રહેતા નથી તેઓ સાક્ષાત્ મોક્ષમાર્ગની સન્મુખ રહે છે. ૪૮. જે પૂર્વબંધના ઉદ્યમાં મમત્વ કરતા નથી. પુષ્ય-પાપને એકસરખા જાણે છે, અંતરંગ અને બાહ્યમાં નિર્વિકાર રહે છે.<sup>૧</sup> જેમના સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણ ઉન્નતિ પર છે. ૪૯. આવી જેમની સ્વાભાવિક દશા છે, તેમને આત્મસ્વરૂપની દુવિધા કેવી રીતે હોઈ શકે ? તે મુનિઓ ક્ષપકશ્રેણી ઉપર ચેત છે અને કેવળી ભગવાન બને છે. ૫૦.

સમ્યગુદૃષ્ટિ જીવોને વંદન (દોહરા)

ઇહિ બિધિ જે પૂરન ભયે, અષ્ટકરમ બન દાહિ।  
તિન્હકી મહિમા જો લખૈ, નમૈ બનારસિ તાહિ॥૫૧॥

**શાલાર્થ :-**—પૂરન ભયે=પરિપૂર્ણ ઉન્નતિને પ્રાપ્ત થયા. દાહિ=બાળીને. લખૈ=જાણે.

**અર્થ :-**—જે આ રીતે આઠ કર્મનું વન બાળીને પરિપૂર્ણ થયા છે, તેમનો મહિમા જે જાણે છે તેને પંડિત બનારસીદાસજી નમસ્કાર કરે છે. ૫૧.

મોક્ષપ્રાપ્તિનો ક્રમ (છ્યા છંદ)  
ભયૌ                  સુદ્ધ                  અંકૂર,  
                                ગયૌ                  મિથ્યાત          મૂર          નસિ।  
ક્રમ                  ક્રમ          હોત          ઉદોત,  
                                સહજ          જિમ          સુકલ          પક્ષ          સસિ॥

૧. દેખાવમાં નેત્રોની લાલાશ અથવા ચહેરાની વક્તા રહિત શરીરની મુદ્રા રહે છે અને અંતરંગમાં કોધાદિ વિકાર હોતા નથી.

બન્ધચ્છેદાત્કલયદતુલં મોક્ષમક્ષયમેત-  
નિત્યોદ્યોતસ્કુટિતસહજાવસ્થમેકાન્તશુદ્ધમ્ ।  
એકાકારસ્વરસભરતોઽત્યન્તગમ્ભીરધીરં  
પૂર્ણ જ્ઞાન જ્વલિતમચલે સ્વસ્ય લીન મહિમિ ॥૧૩॥

કેવળ રૂપ પ્રકાસિ,  
ભાસિ સુખ રાસિ ધરમ ધ્રુવ।  
કરિ પૂરન થિતિ આજુ,  
ત્યાગિ ગત લાભ પરમ હુવ॥  
ઇહ વિધિ અનન્ય પ્રભુતા ધરત,  
પ્રગટિ બૂંડિ સાગર થયૌ।  
અવિચલ અખંડ અનુભય અખય,  
જીવ દરબ જગ મંહિ જયૌ॥૫૨॥

**શાસ્ત્રાર્થ :**—અંકૂર(અંકુર)=ઇઓડ. મૂર (મૂલ)=મૂળમાંથી. સુકલ પક્ષ સસિ (શુકલ પક્ષ શશિ)=અજવાળિયાનો ચન્દ્ર. અનન્ય=જેના સમાન બીજું ન હોય તે—સર્વશ્રેષ્ઠ.

**અર્થ :**—શુદ્ધતાનો અંકૂર પ્રગટ થયો, મિથ્યાત્વ મૂળમાંથી દૂર થયું, શુકલ પક્ષના ચન્દ્રમા સમાન કર્મે કર્મે જ્ઞાનનો ઉદ્ય વધ્યો, કેવળજ્ઞાનનો પ્રકાશ થયો. આત્માનો નિત્ય અને પૂર્ણ આનંદમય સ્વભાવ ભાસવા લાગ્યો, મનુષ્યના આયુષ્ય અને કર્મની સ્થિતિ પૂરી થઈ, મનુષ્ય ગતિનો અભાવ થયો અને પૂર્ણ પરમાત્મા બન્યા. આ રીતે સર્વશ્રેષ્ઠ મહિમા પ્રાપ્ત કરીને પાણીના ટીપામાંથી સમુદ્ર થવા સમાન અવિચણ, અખંડ, નિર્ભય અને અભય જીવ પદાર્થ, સંસારમાં જયવંત થયો. ૫૨.

આઠ કર્મા નાશ પામવાથી આઠ ગુણોનું પ્રગાટ થવું.

(સવૈયા એકબીસા)

ગ્યાનાવરનીકે ગયૈ જાનિયૈ જુ હૈ સુ સબ,  
દર્સનાવરનકે ગયૈતેં સબ દેખિયૈ।  
વેદની કરમકે ગયૈતેં નિરાબાધ સુખ,  
મોહનીકે ગયૈ સુદ્ધ ચારિત વિસેખિયૈ॥

આઉકર્મ ગયેં અવગાહના અટલ હોડી,  
નામકર્મ ગયૈતેં અમૂર્તીક પેખિયૈ।  
અગુરુ અલઘુરૂપ હોત ગોત્રકર્મ ગયેં,  
અંતરાય ગયૈતેં અનંત બલ લેખિયૈ॥૫૩॥

**શાબ્દાર્થ :**—નિરાભાધ રસ=શાતા-અશાતાના ક્ષોભનો અભાવ. અટલ અવગાહના=ચારે ગતિના ભ્રમણનો અભાવ. અમૂર્તિક=ચર્મચક્ષુઓથી અગોચર. અગુરુ અલઘુ=ન ઉંચ, ન નીચ.

**અર્થ :**—જ્ઞાનાવરણીય કર્મના અભાવથી કેવળજ્ઞાન, દર્શનાવરણીય કર્મના અભાવથી કેવળદર્શન, વેદનીય કર્મના અભાવથી નિરાભાધતા, મોહનીય કર્મના અભાવથી શુદ્ધ ચારિત્ર, આયુષ્યકર્મના અભાવથી અટળ અવગાહના, નામકર્મના અભાવથી અમૂર્તિકપણું, ગોત્રકર્મના અભાવથી અગુરુલઘુત્વ અને અંતરાયકર્મનો નાશ થવાથી અનંતવીર્ય પ્રગટ થાય છે. આ રીતે સિદ્ધ ભગવાનમાં અષ્ટકર્મ રહિત હોવાથી અષ્ટ ગુણ હોય છે. ૫૩.

### નવમા અધિકારનો સાર

પ્રસિદ્ધ છે કે મિથ્યાત્વ જ આસ્રવ બંધ છે અને મિથ્યાત્વનો અભાવ અર્થાત્ સમ્યક્ત્વ તે સંવર, નિર્જરા તથા મોક્ષ છે અને મોક્ષ આત્માનો નિર્જસ્વભાવ અર્થાત્ જીવની કર્મમળ રહિત અવસ્થા છે. વાસ્તવમાં વિચારવામાં આવે તો મોક્ષ થતો જ નથી, કેમકે નિશ્ચયનયમાં જીવ બંધાયો નથી—અબંધ છે, અને જ્યારે અબંધ છે ત્યારે છૂટશે શું? જીવનો મોક્ષ થયો એ કથન વ્યવહાર માત્ર છે, નહિ તો તે હમેશાં મોક્ષરૂપ જ છે.

આ વાત જગપ્રસિદ્ધ છે કે જે મનુષ્ય બીજાના ધન ઉપર પોતાનો અધિકાર જમાવે છે, તે મૂર્ખને લોકો અન્યાયી કહે છે જો તે પોતાની જ સંપત્તિનો ઉપયોગ કરે છે તો લોકો તેને ન્યાયશીલ કહે છે. એવી જ રીતે જ્યારે આત્મા પરદ્રવ્યોમાં અહંકાર કરે છે, ત્યારે તે અજ્ઞાની, મિથ્યાત્વી થાય છે અને જ્યારે આવી ટેવ છોડીને તે આધ્યાત્મિક વિદ્યાનો અભ્યાસ કરે છે તથા આન્તિકરસનો સ્વાદ લે છે ત્યારે પ્રમાણનું પતન કરીને પુણ્ય-પાપનો ભેદ મટાડી દે છે અને ક્ષપકશ્રેણી ચડીને કેવળી ભગવાન

બને છે. પછી થોડા જ સમયમાં આઠ કર્મ રહિત અને આઠ ગુણ સહિત સિદ્ધપદને પામે છે.

મુખ્ય અભિપ્રાય મમતા દૂર કરવાનો અને સમતા લાવવાનો છે. જેવી રીતે સોનીના સંગે સોનાની જુદી જુદી અવસ્થાઓ થાય છે પરંતુ તેનું સુવર્ણપણું ચાલ્યું જતું નથી, ગાળવાથી પાછું સોનાનું સોનાનું જ બન્યું રહે છે, તેવી જ રીતે આ જીવાત્મા અનાત્માના સંસર્ગથી અનેક વેશ ધારણ કરે છે, પરંતુ તેનું ચૈતન્યપણું ક્યાંય ચાલ્યું જતું નથી—તે તો બ્રહ્મનું બ્રહ્મ જ બન્યું રહે છે. તેથી શરીરનું મિથ્યા અભિમાન છોડીને આત્મસત્તા અને અનાત્મસત્તાનું પૃથક્કરણ કરવું જોઈએ, અને કરવાથી થોડા જ સમયમાં આધુનિક બુંદ માત્ર જ્ઞાન અલ્પકાળમાં જ સમુદ્રરૂપ પરિણામન કરે છે અને અવિયળ, અખંડ, અક્ષય, અનભય અને શુદ્ધ સ્વરૂપ થાય છે.

